



**NILA
INFRASTRUCTURES
LIMITED**

Nila/Cs/2026/30
Date: May 04, 2026

To,
The Department of Corporate Services
BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street,
Mumbai - 400 001

Scrip Code: 530377

To,
The Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, C/1, Block G,
Bandra-Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Scrip Symbol: NILAINFRA

Dear Sir,

Reg: Submission of Newspaper Publication of Extract of Financial Results for the Quarter and Year ended on March 31, 2026

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are hereby submitting newspaper publication of Extract of Audited Standalone & Consolidated Financial Results for the quarter and year ended on March 31, 2026, as published in Business Standard – English and Loksatta Jansatta- Gujarati in May 04, 2026 edition.

Kindly take the same on your record and acknowledge the receipt.

Thanking you,
Yours faithfully,
For, Nila Infrastructures Limited

Dipen Y Parikh
Company Secretary

Encl: a/a

Registered Office:

1st floor, Sambhaav House
Opp. Chief Justice's Bungalow
Bodakdev, Ahmedabad 380015
Tel.: +91 79 4003 6817 / 18, 2687 0258
Fax: +91 79 3012 6371
e-mail: info@nilainfra.com

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES
APPENDIX - IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]

**Branch: Gandhi Chowk
Tal Godhra, Dist.Panchmahals**

**बैंक ऑफ बड़ोदा
Bank of Baroda**

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002
READ WITH PROVISIO TO RULE 6(2) & 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) Mortgagee(s) and Guarantor (s) that the below described immovable property mortgaged / charged to the Secured Creditor, possession of which has been taken by the Authorized Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower/s / Mortgagee / Guarantor/s / Secured Asset/s / Dues / Reserve Price / e-Auction Date & Time, EMD and Bid Increase Amount are mentioned below:-

Sr./ Lot No.	Name & Address of Borrower/s / Guarantor/s / Mortgagee/s	Total Amount Dues	Date & Time of E-Auction	Reserve Price EMD and Bid Increase Amt.	EMD Start Date and Time	Status of Possession (Symbolic / Physical)	Property Inspection Date & Time
1.	M/s. Vraj Enterprise, Add:- Vrajidham "57", Maa Gayatri Nagar, Near Goverdhan Nathiji Haveli Bamroli road, Godhra, Panchmahals Gujrat-389001. Mrs. Poonam Rupesh Jobanputra (Proprietor & Mortgagee)	Rs. 1,97,05,234.08/- + unapplied interest + other charges less recovery if any	04.06.2026 From 2 PM To 6 PM	1) Rs.39,31,000/- 2) Rs.3,93,100/- 3) Rs.10,000/-	02.05.2026 to 04.06.2026 From 10.00 AM - 6.00 PM	Symbolic	On 02.05.2026 to 04.06.2026 From 10.00 AM to 1.00 PM

Give short description of the immovable property with known encumbrances (Mortgaged by: Mrs. Poonam Rupesh Jobanputra): Part A: All that part and parcel of the property situated at Old R.S. No. 250 paiki 5, New C.S. No. NA 250/Paiki/55, Plot No.55 admeasuring 70.00 sq. mtrs. NA land situated at Godhra Kasba, Ta. Godhra, District PMS belonging to Mrs. Poonam Rupesh Jobanputra. **Descriptions Bounded as under: Plot No. 55:** East: Land of R.S.No. 251, West: 6.00 Meter Road, North: Plot No. 54, South: Plot No. 56. **Part B:** All that part and parcel of the property consisting Immovable Property situated at Old R.S. No. 250 paiki 5, New C.S. No. NA 250/Paiki/56, Plot No.56 admeasuring 112.00 sq. mtrs. NA land situated at Godhra Kasba, Ta. Godhra, District PMS belonging to Mrs. Poonam Rupesh Jobanputra. **Bounded as under: Plot No. 56:** East: Land of R.S.No. 251, West: 6.00 Meter Road, North: Plot No. 55, South: 6.00 Meter Road.

This term and conditions are only for symbolic possession.
1. Property is in Symbolic Possession and Bidder is purchasing the property in symbolic possession at his/own risk & responsibility. 2. Bank will hand over the possession of property symbolically only and Successful Auction bidder/purchaser will not claim physical possession from the Bank. 3. Bank will not be responsible or duty bound for handing over of physical possession. 4. Successful Auction Purchaser will not be entitled to claim any interest, in any f. case of return of money. 5. Successful Auction Purchaser has to submit the Declaration Cum Undertaking confirming the above terms & condition immediately after e-Auction. 6. Subsequent to sale if successful bidder fails to submit Declaration Cum Undertaking, the bid EMD amount will be forfeited.

15/30 DAYS STATUTORY SALE NOTICE TO THE BORROWER, GUARANTOR AND MORTGAGOR
For detailed terms and conditions of sale, please refer / visit to the Website link <https://www.bankofbaroda.in/e-auction.htm> and online auction portal <https://baanet.com>. Also, prospective bidders may contact the Authorized Officer on Mobile No. 9687678914.

SCAN HERE For detailed terms & conditions.

NIDO HOME FINANCE LIMITED
(formerly known as Edelweiss Housing Finance Limited)

Registered Office Situated At Tower 3, 5th Floor, Wing 'B', Kohnoor City Mall, Kohnoor City, Kiroi Road, Kuria (West), Mumbai - 400 070. Regional Office at: Office No. 302,303,304, 3rd Floor, 3rd Eye Vision Building, IIM - Panjrapole Road, Ahmedabad - 380015

POSSESSION NOTICE UNDER RULE 8(1) OF THE SARFAESI ACT, 2002

Whereas the Undersigned being the Authorized Officer of Nido Home Finance Limited (formerly known as Edelweiss Housing Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance 2002 (order 3 of 2002) and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued Demand Notices to the Borrower/s as detailed hereunder, calling upon the respective Borrowers to repay the amount mentioned in the said notices with all costs, charges and expenses till actual date of payment within 60 days from the receipt of the same. The said Borrowers/Co borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Co borrowers and the public in general that the undersigned has taken symbolic possession of the property described hereunder in exercise of powers conferred on him under Section 13(4) of the said Act and Rule 8 of the said Rules in the dates mentioned along-with the Borrowers in particular and public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Nido Home Finance Limited (formerly known as Edelweiss Housing Finance Limited). For the amount specified therein with future interest, costs and charges from the respective dates.

Details of the Borrowers, Co-borrowers and Guarantors, Securities, Outstanding Dues, Demand Notice sent under Section 13(2) and Amount claimed thereunder and Date of Possession is given as under:

1. Name and Address of the Borrower, Co Borrower Guarantor Loan Account No. And Loan Amount:-
ABDULKHAN ANWARKHAN RATHOD (Borrower) SAHIBNEN ABDUL RATHOD (Co-Borrower) Res Address: Flat No 404, Al Makhdum Plaza, Nr Miyagam Karjan, Station Bs, Karjan Fire Station, Karjan Vadodara Vadodara 391240
LAN.No.: L0270STH000005334868 **Loan agreement Date:** 10/07/2024
Loan Amount: Rs. 11,30,000/- (Rupees Eleven Lakh Thirty Thousand Only) **Demand Notice Date:** 19-12-2025
Amount Due in Rs. 11,78,905.76/- (Rupees Eleven Lacs Seventy Eight Thousand Nine Hundred Five & and Seventy Six paise Only) **Constructive / Symbolic Possession date:** 02-05-2026

Schedule Of The Property: All The Piece And Parcel Of The Immovable Property Being Non-Agricultural Plot Of Land In Mauje Karjan, Vadodara Lying Being And Situated On The Land Bearing C.S. No. 2540, Sheet No. 33, Chatta No. 121 As Per City Survey Record Admeasuring 644.53 Sq. Mtrs. Known As "Al-Makhdum Plaza", Fourth Floor, Flat No. 404 Admeasuring 39.56 Sq. Mtrs. I.E. 415 Sq. Fts., At Registration Sub District Karjan District Vadodara. **Boundaries:** East: By C.S. No. 2543 & 2548, West: By Complex Passage, North: By Flat No. 405, South: By Flat No. 403

Place: VADODARA **Sd/- Authorized Officer**
Date: 04.05.2026 **FOR Nido Home Finance Limited, (formerly known as Edelweiss Housing Finance Limited)**

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES
APPENDIX - IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]

**Branch: Gandhi Chowk
Tal Godhra, Dist.Panchmahals**

**बैंक ऑफ बड़ोदा
Bank of Baroda**

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002
READ WITH PROVISIO TO RULE 6(2) & 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) Mortgagee(s) and Guarantor (s) that the below described immovable property mortgaged / charged to the Secured Creditor, possession of which has been taken by the Authorized Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower/s / Mortgagee / Guarantor/s / Secured Asset/s / Dues / Reserve Price / e-Auction Date & Time, EMD and Bid Increase Amount are mentioned below:-

Sr./ Lot No.	Name & Address of Borrower/s / Guarantor/s / Mortgagee/s	Total Amount Dues	Date & Time of E-Auction	Reserve Price EMD and Bid Increase Amt.	EMD Start Date and Time	Status of Possession (Symbolic / Physical)	Property Inspection Date & Time
1.	M/s. Balaji Enterprise, Add:- Vrajidham "57", Maa Gayatri Nagar, Near Goverdhan Nathiji Haveli Bamroli road Godhra, Panchmahals Gujrat-389001. Mrs. Kritiben Prakash Jobanputra (Proprietor) Mr. Rupesh Prakash Jobanputra (Guarantor & Mortgagee) Mrs. Poonam R Jobanputra (Guarantor) (CC LOAN) Mr. Rupesh Prakash Jobanputra (Borrower & Mortgagee) Mrs. Poonam R Jobanputra (Co-Borrower) (HOME LOAN)	Rs. 2,16,36,002.75/- + unapplied interest + other charges less recovery if any	04.06.2026 From 2 PM To 6 PM	1) Rs.2,57,15,000/- 2) Rs.25,71,500/- 3) Rs.10,000/-	02.05.2026 to 04.06.2026 From 10.00 AM - 6.00 PM	Symbolic	On 02.05.2026 to 04.06.2026 From 10.00 AM to 1.00 PM
	Rs. 2,27,61,736.27/- + unapplied interest + other charges less recovery if any						
	Rs. 4,43,97,739.02/- + unapplied interest + other charges less recovery if any						

Give short description of the immovable property with known encumbrances (Mortgaged by: (Mr. Rupesh Prakash Jobanputra): All that part and parcel of the property consisting Immovable Property bearing revenue survey no. 250 paiki, plot no 57 & 58, admeasuring 280.00 sq. meter situated at Godhra Kasba, Taluka Godhra, District Panchmahal, Gujarat. 389001 belonging to Mr. Rupesh Prakash Jobanputra. **Bounded as under: Plot No. 57:** East: S.No. 251, West: 6.00 Meter Road, North: 6.00 Meter Road, South: Plot No. 58. **Plot No. 58:** East: S.No. 251, West: 6.00 Meter Road, North: Plot No. 57, South: Plot No. 59.

This term and conditions are only for symbolic possession.
1. Property is in Symbolic Possession and Bidder is purchasing the property in symbolic possession at his/own risk & responsibility. 2. Bank will hand over the possession of property symbolically only and Successful Auction bidder/purchaser will not claim physical possession from the Bank. 3. Bank will not be responsible or duty bound for handing over of physical possession. 4. Successful Auction Purchaser will not be entitled to claim any interest, in any f. case of return of money. 5. Successful Auction Purchaser has to submit the Declaration Cum Undertaking confirming the above terms & condition immediately after e-Auction. 6. Subsequent to sale if successful bidder fails to submit Declaration Cum Undertaking, the bid EMD amount will be forfeited.

15/30 DAYS STATUTORY SALE NOTICE TO THE BORROWER, GUARANTOR AND MORTGAGOR
For detailed terms and conditions of sale, please refer / visit to the Website link <https://www.bankofbaroda.in/e-auction.htm> and online auction portal <https://baanet.com>. Also, prospective bidders may contact the Authorized Officer on Mobile No. 9687678914.

SCAN HERE For detailed terms & conditions.

Canara Bank **CANARA BANK - ALKAPURI BRANCH**
Opp. Express Hotel, R.C. Dutt Road, Alkapuri, Vadodara. Tel. 0265-2338115

POSSESSION NOTICE
(For Immovable Property)
(Appendix IV under the Act - Rule 8(1))

Whereas, The undersigned being the Authorised Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 21/02/2026 calling upon the borrower/surety/owner Mrs. Rajeshdevi Kawarpal Chauhan B 404 Siddharth Heights New Vip Road Near Raghukul School Vadodara- 390022 (borrower And Mortgagee) And Mr. Sandeep Kawarpalsingh Chauhan B 404 Siddharth Heights New Vip Road Near Raghukul School Vadodara- 390022 (co-borrower) to repay the amount mentioned in the notice being Rs. 18,34,443.12 (Rs. Eighteen Lac Thirty-Four Thousand Four Hundred Forty- Three and Twelve paise only) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 01th day of May 2026.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank for an amount of Rs. 18,34,443.12 (Rs. Eighteen Lac Thirty-Four Thousand Four Hundred Forty-Three and Twelve paise only) and interest thereon.

The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
All the piece and parcel of Flat No. B-404 having super built up area 100.43 sq mtrs (1081 sq ft) on 4th floor in Tower B of "Siddharth Heights" situated on sub plot no. A/125, C/126, C/127, A/128, to A/133 of bakor Nagar on land bearing R.S no 184/5, draft TP scheme no.06, F.P no.45/1,45/4 paiki, 45.C.S no. 189 of moje village Savad Taluka & District Vadodara. (CERSAI ID- 400011980988). Property Owned by- Mrs. Rajeshdevi Kawarpal Chauhan. Bounded: North: Open Land, South: Lift and Common Passage, East: Flat No. B-401, West: Tower C.

Date: 01.05.2026, **Place:** Vadodara **Authorised Officer, Canara Bank**

NILA INFRASTRUCTURES LIMITED
(CIN : L45201GJ1990PLC013417)
Registered Office: 1st Floor, Sambhav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.
Phone: +91 79 4003 6817/18 Fax: +91 79 26873922
E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2026
(₹ in Lakhs, except per share data)

SN	Particulars	Standalone					Consolidated				
		Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended			
		31-03-2026	31-12-2025	31-03-2025	31-03-2026	31-03-2025	31-03-2026	31-12-2025	31-03-2025	31-03-2026	31-03-2025
1	Total Income from Operations	8,103.91	7,503.49	11,341.90	32,270.66	24,688.10	8,103.91	7,503.49	11,341.90	32,270.66	24,688.10
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional items)	914.35	843.86	863.97	3,757.14	2,989.14	845.20	707.76	788.87	3,386.85	2,873.02
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional items)	914.35	843.86	863.97	3,757.14	2,989.14	845.20	707.76	788.87	3,386.85	2,873.02
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional items)	654.10	600.83	607.61	2,699.11	2,153.65	584.95	464.73	536.05	2,328.82	2,049.85
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	659.10	578.84	604.11	2,682.20	2,150.15	590.03	442.74	532.55	2,311.91	2,046.35
6	*Equity Share Capital (Face Value of ₹ 1/- per share)	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89
7	Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)				16,846.56	14,164.36				14,794.60	12,482.69
8	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)										
	Basic (in ₹)	0.17	0.15	0.15	0.69	0.55	0.15	0.12	0.14	0.59	0.52
	Diluted (in ₹)	0.17	0.15	0.15	0.69	0.55	0.15	0.12	0.14	0.59	0.52

1. The above is an extract of the detailed format of quarter and year ended Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 02, 2026 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarter and year ended Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.nilainfra.com.

2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.

3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Place: Ahmedabad
Date: May 02, 2026

By Order of the Board of Directors
Sd/-
Manoj B Vadodaria
Chairman and Managing Director
DIN: 00092053

सेंट्रल बैंक ऑफ इंडिया **SUBHANPURA BRNCH**
सेंट्रल बैंक ऑफ इंडिया
Central Bank of India
CENTRAL TO YOU SINCE 1911

VADODARA.

APPENDIX - IV [See rule - 8(1)]
POSSESSION NOTICE
(FOR IMMOVABLE PROPERTY)

Whereas, the Authorised officer of the Central Bank of India, Subhanpura Branch under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, and in exercise of powers conferred under Section 13 (2) and 13 (12) read with the Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice Dated 20.01.2026 calling upon the borrower Mr. Kanaitya Vajjabhai Gamit to repay the amount mentioned in the notice being Rs 11,98,361.72/- (Rs Eleven Lakh Ninety Eight Thousand Three Hundred Sixty One & Seventy Two paise only) (which represents the principal plus interest due as on the 20.01.2026, plus interest and other charges from 20.01.2026 to till date within 60 days from the date of receipt of the said notice. Then after you have merely paid Rs. Nil on dated NA, no further deposited by you.

The Borrower having failed to pay the entire dues of the bank, notice is hereby given to the borrower, the Guarantor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13 (4) of the said act, read with Rule 8 of the Security Interest (Enforcement) Rule 2002 on this 02.05.2026.

The borrower and the Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to charge of Central Bank of India, for the amount of Rs 11,98,361.72/- (Rs Eleven Lakh Ninety Eight Thousand Three Hundred Sixty One & Seventy Two paise only) (which represents the principal plus interest due on the 20.01.2026), plus interest and other charges from 20.01.2026.

The borrower's attention is invited to provisions of sub section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

Immovable asset
In Registration District Vadodara and sub district Vadodara Moje Village Gorwa RS no 315 City Survey no 3801 lands where in Gujarat Housing Board colony: 162 MIG-1+18 shops, plot B phase 2 Gorwa, Vadodara, where in 9th Floor flat No. B 903 of tower having carpet area adm. 65sq meters. Bounded By: East: Common Passage and Lift, West: Open Marginal Space, North: Adjoining Flat No B-904, South: Road & Open Marginal Space.

Date: 02.05.2026- **Place:** Baroda **Authorised Officer, Central Bank of India**

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES
APPENDIX - IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]

**Branch: Gandhi Chowk
Tal Godhra, Dist.Panchmahals**

**बैंक ऑफ बड़ोदा
Bank of Baroda**

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002
READ WITH PROVISIO TO RULE 6(2) & 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) Mortgagee(s) and Guarantor (s) that the below described immovable property mortgaged / charged to the Secured Creditor, possession of which has been taken by the Authorized Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower/s / Mortgagee / Guarantor/s / Secured Asset/s / Dues / Reserve Price / e-Auction Date & Time, EMD and Bid Increase Amount are mentioned below:-

Sr./ Lot No.	Name & Address of Borrower/s / Guarantor/s / Mortgagee/s	Total Amount Dues	Date & Time of E-Auction	Reserve Price EMD and Bid Increase Amt.	EMD Start Date and Time	Status of Possession (Symbolic / Physical)	Property Inspection Date & Time
1.	M/s. Rajai Motors, Add: Opposite Moon Light, Dahod Road, Vavdi, Godhra, District - Panchmahals - 389001, Gujarat Kishorekumar Thakordas Rajai (Partner & Guarantor & Mortgagee), Add: 4-AK-16, Ankur Society, Bamroli Road, Godhra, District - Panchmahals - 389001, Gujarat Mr. Nikhil Kishorekumar Rajai (Partner and Guarantor), Add:- 16, Ankur Society, Bamroli Road Godhra, District - Panchmahals - 389001, Gujarat Mrs. Romaben Kishorekumar Rajai (Partner and Guarantor and Mortgagee), Add: 4-AK-16, Ankur Society, Bamroli Road, Godhra, District - Panchmahals - 389001, Gujarat	Rs. 10,56,45,631.24 + unapplied interest + other charges less recovery if any	21.05.2026 From 2 PM To 6 PM	1) Rs. 12,20,11,650/- 2) Rs. 1,22,01,165/- 3) Rs. 10,000/-	02.05.2026 to 21.05.2026 From 10.00 AM - 6.00 PM	Physical	On 02.05.2026 to 21.05.2026 From 10.00 AM to 1.00 PM

Give short description of the immovable property with known encumbrances (Mortgaged by: Kishorekumar Thakordas Rajai and Romaben Kishorekumar Rajai): Immovable commercial property situated at plot no.1 to 11 total admeasuring 1705.60 sqmtrs and plot no.12,13/P Northern part, 14,15,16,24,33,34,35,38,39 total admeasuring land 1516.67 sqmtrs of R.S. No. 233+234 paiki along with showroom (GPH no.974) which is situated at village- Vavdi Bujarg, Tal: Godhra, Panchmahal, Gujarat-389001 belonging to Mr. Kishore Thakordas Rajai and Romaben Kishorekumar Rajai**

Described as under: Part A: All that part and parcel of the property consisting Immovable Property situated at plot no.1 to 11 total admeasuring 1705.60 sqmtrs which is situated at village- Vavdi Bujarg, Tal: Godhra, Panchmahal, Gujarat - 389001 belonging to Mr. Kishore Thakordas Rajai and Romaben Kishorekumar Rajai. **Bounded as under:**

Plot No.	East	West	North	South
1	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Open Land	Land of plot No. 2
2	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.1	Land of plot no. 3
3	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.4	Land of plot no. 6
4	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.2	Land of plot no. 4
5	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.6	Land of plot no. 8
6	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.3	Land of plot no. 6
7	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.5	Land of plot no. 7
8	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.7	Land of plot no. 8
9	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.8	Land of plot no. 9
10	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.9	Land of plot no. 10
11	6 Mtrs. Road	Land of Revenue Survey No. 235	Land of plot no.10	Land of plot no. 12

Part B: All that part and parcel of the property consisting Immovable Property situated at plot no.12,13/P Northern part, 14,15,16,24,33,34,35,38,39 total admeasuring land 1516.67 sqmtrs of R.S. No. 233+234 paiki along with showroom (GPH no.974) belonging to Mr. Kishore Thakordas Rajai and Romaben Kishorekumar Rajai. **Bounded as under:**

Plot No.	East	West	North	South
12	Road	Land of R S no.235	Plot No.11	Plot No. 13
13/P	Road	Moon Light Cinema	Remaining of Plot No.13	R.S.No. 235
14	Plot No.40	Road	Plot No.15	R.S.No. 235
15	Plot No.39	Road	Plot No.16	Plot No.14
16	Plot No.38	Road	Plot No.17	Plot No.15
17	Plot No.30	Road	Plot No.25	Plot No.23
18	Plot No.33	Road	Plot No.32	Plot No.34
19	Plot No.20	Road	Plot No.33	Plot No.35
20	Plot No.19	Road	Plot No.34	Plot No.36
21	Plot No.16	Road	Plot No.37	Plot No.39
22	Plot No.15	Road	Plot No.38	Plot No.40

**Encumbrances: The Sale Tax department Godhra has created charge over the said property in revenue record for their dues of Rs.60,93,40,263/- against Rajai Motors. However the Bank holds priority of charge as per section 26(E) of SARFAESI Act 2002. Hence the purchaser may not get burden of this sale tax dues after purchase of the property from the Bank under SARFAESI Act.

15/30 DAYS STATUTORY SALE NOTICE TO THE BORROWER, GUARANTOR AND MORTGAGOR
For detailed terms and conditions of sale, please refer / visit to the Website link <https://www.bankofbaroda.in/e-auction.htm> and online auction portal <https://baanet.com>. Also, prospective bidders may contact the Authorized Officer on Mobile No. 9687678914.

SCAN HERE For detailed terms & conditions.

Canara Bank **CANARA BANK - RAJPIPLA BRANCH**
Canara Bank (erstwhile syndicate bank)
Shiv Shakti Building Mahavidyalaya Road Santosh, Vijay Char Rasta, Rajpipla, Gujarat.

DEMAND NOTICE

Sub: DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002
That Borrowers have availed the following loans/credit facilities from our Bank from time to time:

Branch & Borrower's Name - Address	DESCRIPTION OF THE SECURED ASSETS	Demand Notice Date	Loan Details	Total Due Amount
Rinkal Hirenbbhai Italiya A-67, Snehmilan Bunglows, Bh. Hira Mandir Nana Varach, Surat, Chorasri Surat - 395006 (Borrower and Mortgagee)	All the piece and parcel of land and buildings existing and/or to be constructed thereon and shown under schedule "B" below together with easementary and appurtenances thereto registration district Narmada sub district Nandod land bearing (old r block /survey no. 891) new R block/survey no. 1906 House no. 22, area of land 70.70 sq mtrs undivided share of land 53 sq mtrs Total land area 123.70 sq mtrs land in the area known as "chandravilla Bunglow" of Moje Rajpipla Ta. Nandod Dis. Narmada. CERSAI ID-400066419568 Bounded as: North - Plot/House no. 19 South: 6 mtrs broad road East:- Plot/House no. 23 West:- Plot/House no.21	29.04.2026 Date of NPA	Housing Loan A/c 160001237151 Rs. 28,29,000.00	Principal as on 26,89,418.00 Interest and other charges 91,532.32 Total Liability 27,80,950.32
		24.04.2026	SANCTION DATE 24.11.2022 Rate Of Interest 11.95 % (inclusive of penal charge- 2%)	

The above said loan/credit facilities are duly secured by way of mortgage of the assets more specifically described in the schedule hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as NPA as above. Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of Rs. 27,80,950.32 above with accrued and up-to-date interest and other expenses, within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section

ટાટા સન્સ લાંબા સમયથી એવી રીતે વર્ગીકૃત થવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે

RBIના નિયમોથી ટાટા સન્સનો IPO રડાર પર

જાહેર ભંડોળમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારની પહોંચ ધરાવતા શેડો ધિરાણકર્તાને સૂચિબદ્ધ કરવું આવશ્યક

નવી દિલ્હી, તા.૩

ભારતના મધ્યસ્થ બેંક દ્વારા શેડો લેન્ડર્સની વ્યાખ્યામાં કરાયેલા ફેરફારથી ટાટા સન્સ પ્રા.ને નજીકના ભવિષ્યમાં વિસ્તૃત કરવાની ફરજ પડી શકે છે કે કેમ તે અંગે ચર્ચા ફરી શરૂ થઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે એસોસિએટેડ અને યુપ એન્ટિટીઝ પાસેથી નાણાં સ્વીકારતા શેડો ધિરાણકર્તાઓને જાહેર ભંડોળમાં પરોક્ષ પ્રવેશ ધરાવતા તરીકે ગણવામાં આવશે. આવા ભંડોળની સ્વીકૃતિનો અર્થ એ છે કે સ્ટીલ-ટુ-સેમિકન્ડક્ટર સામ્રાજ્યને અવગણતા ટાટા સન્સને ૧ જુલાઈથી અમલમાં આવનારા નિયમનકારના નવા નિયમોનું પાલન કરવા માટે પ્રારંભિક જાહેર ઓફર



નવી પડી શકે છે.

એશિયાના સૌથી જૂના બિઝનેસ ગ્રુપમાંના એક, ટાટા સન્સ લાંબા સમયથી એવી રીતે વર્ગીકૃત થવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જેનાથી સામાન્ય રીતે ટોચના સ્તરના અથવા મોટા શેડો ધિરાણકર્તાઓ સાથે સંકળાયેલા કડક ટેમ્પરેચને આમંત્રણ

વર્ગીકૃત કરવામાં આવી હોવા છતાં, જાહેર ઓફર માટે જવા માટે સપ્ટેમ્બર ૨૦૨૫ ની સમયમર્યાદા ચૂકી ગઈ. આ વિભાગ હેઠળની કંપનીઓને એકસરેખે જ સૂચિબદ્ધ કરવાની હોય છે.

નિયમિત કાર્યકારી સમય સિવાય ટાટા સન્સને મોકલવામાં આવેલ એક ઈમેઇલનો જવાબ મળ્યો ન હતો. ૨૦૨૪ માં, ટાટા સન્સે “મુખ્ય રોકાણ કંપની” તરીકે નોંધણીના પ્રમાણપત્રને સ્વેચ્છિક રીતે સોંપવા માટે ઈમેલને અરજ કરી હતી. ખાનગી માલિકીની એન્ટિટી રહેવાથી ટાટા ટ્રસ્ટ માટે કડક નિયંત્રણ, જાહેરમાં ટ્રેડ થતી કંપનીઓ સાથે જોડાયેલ બજાર જાહેરાત અને શાસન આવશ્યકતાઓને ટાળવા અને જૂથમાં લાંબા ગાળાના મૂડી ફાળવણીમાં વધુ સુગમતા રહે છે.

SBI IPOમાં પોતાનો લગભગ ૬.૩% ઇક્વિટી હિસ્સો વેચશે

SBI IPO રોકાણકારો માટે રોડ શો કરવાની યોજના: આશરે \$૧.૩ બિલિયનનું મૂલ્ય રહેશે

નવી દિલ્હી, તા.૩

દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ડેન્ચ મની મેનેજર અમુન્ડી એસેટ મેનેજમેન્ટ વેન્ચર SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડના આયોજિત પ્રારંભિક જાહેર ઓફર માટે રોકાણકારોના રોડ શોની તૈયારી કરી રહ્યા છે.

SBI ફંડ્સ મેનેજમેન્ટે ૧૯ માર્ચે બજાર નિયમનકાર સિક્કોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને સ્ટોક એક્સચેન્જ સમક્ષ આયોજિત ઈક્વિટી વેચાણ માટે ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યો હતો. IPOનું કદ લગભગ \$૧.૩ બિલિયન હોઈ શકે છે, જે SBI ફંડ્સનું એકંદર મૂલ્યાંકન \$૧૩ બિલિયનની આસપાસ હોવાનું જણાવે છે, SBI ફંડ્સ મેનેજમેન્ટનું મૂલ્ય આશરે \$૧૫ બિલિયન આંકી શકે છે, જે તેને ભારતમાં વિસ્તૃત કરાયેલી સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ



કંપનીમાંની એક બનાવે છે. આ મૂલ્યાંકન તેને ICICI પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપનીથી નીચે મૂકે છે, જેનું પોતાનું વિસ્તૃત પછી વર્તમાન મૂલ્યાંકન લગભગ \$૧૬.૭ બિલિયન છે. IPO ની અંતિમ વિગતો, જેમાં કદ અને માળખું શામેલ છે, હજુ પણ ચર્ચામાં છે.

IPO યોજનાનું સંચાલન કરતી બેંકોમાં કોટક ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, એક્સિસ કેપિટલ, BofA સિક્કોરિટીઝ, HSBC, આઈસીઆઈસીઆઈ સિક્કોરિટીઝ, જેફરીઝ, જેએમ કાર્થનાશિયલ, મોનીલાલ ઓસ્વાલ અને એસબીઆઈમૂડી બજારો. SBI અને અમુન્ડી ઈન્ડિયા હોલિંગ્સે ૬ નવેમ્બરના રોજ SBI ફંડ્સને લિસ્ટ કરવાની યોજનાઓનું અનાવરણ કર્યું હતું.

બિઝનેસ આજકાલ

RBIનો નવો નિયમ: કાર્ડ બદલાશે તો પણ ઓટો પેમેન્ટ બંધ નહીં થાય

નવી દિલ્હી: રિઝર્વ બેંકના નવા નિયમથી ગ્રાહકોને મોટો ફાયદો; નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ આવતાની સાથે જ OTT, વીમા પ્રીમિયમ અને SIP જેવા ઓટો પેમેન્ટ્સ આપમેળે નવા કાર્ડ સાથે લિંક થઈ જશે, હવે કોઈ પેનલ્ટી નહીં લાગે. ગ્રાહકોને આ માથાફૂટમાંથી કાયમી છુટકારો અપાવવા માટે RBI એ નવો નિયમ લાગુ કર્યો છે. તમારું નવું કાર્ડ આવતાની સાથે જ તમામ ઓટો પેમેન્ટ્સ આપમેળે નવા કાર્ડ સાથે લિંક થઈ જશે અને તમારું કોઈ પેમેન્ટ અટકશે નહીં. અત્યાર સુધી એવું થતું હતું કે, જ્યારે પછાત તમારે નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લેવું પડે, ત્યારે જૂના કાર્ડ પર સેટ કરેલા ઓટો પેમેન્ટ્સ જેવી કે OTT પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન, વીમાનું પ્રીમિયમ કે SIP વગેરે બંધ થઈ જતા હતા.

ડેરિવેટિવ્સ ટર્નઓવર ૬% ઘટ્યું, કેશમાં ૭% વધ્યું

નવી દિલ્હી: સમાપ્ત થયેલા એપ્રિલમાં દેશની ઈક્વિટી માર્કેટમાં કેશ તથા ડેરિવેટિવ્સ વેપારમાં વિરોધાભાષી સ્થિતિ જોવા મળી હતી. કેશ વેપારના ટર્નઓવરમાં માસિક ધોરણે સાત ટકા વધારો જોવા મળ્યો હતો જ્યારે ડેરિવેટિવ્સના વેપારમાં સરેરાશ ડેનિક ટર્નઓવરમાં ૬ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ૧લી એપ્રિલથી સિક્કોરિટીઝ ટ્રાન્ઝાક્શન ટેકસ (એસટી) માં વધારો લાગુ થવાને પરિણામે ડેરિવેટિવ્સના ટર્નઓવર પર અસર જોવા મળી છે. ૧લી એપ્રિલથી ફ્યુચર્સના વેપાર પર એસટી ૦.૦૨ ટકા પરથી વધારી ૦.૦૫ ટકા કરાયો છે. જ્યારે ઓપનમાં આ આંક ૦.૧૦ ટકાથી પરથી વધારી ૦.૧૫ ટકા કરાયો છે.

કેશ સેગમેન્ટમાં DIInી એપ્રિલમાં ૫૧૦૦૦ કરોડની લેવાલી

મુંબઈ: વર્તમાન વર્ષના માર્ચમાં ઈક્વિટી કેશમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની આક્રમક ખરીદી રહ્યા બાદ એપ્રિલમાં ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચની સરખામણીએ એપ્રિલમાં નબળી ખરીદી ડીઆઈઆઈ યુદ્ધની સ્થિતિમાં સાવચેતીનું વલણ ધરાવતા હોવાના સંકેત આપે છે. માર્ચમાં ડીઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં રૂપિયા ૧,૪૨,૯૬૦ કરોડની નેટ લેવાલી રહી હતી જ્યારે એપ્રિલનો આ આંક રૂપિયા ૫૧૦૬૩ કરોડ રહ્યો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ ફાટી નિકળ્યા બાદ માર્ચમાં ડીઆઈઆઈની ઘરેલુ ઈક્વિટી માર્કેટમાં સતત ખરીદી ચાલુ રહેતા શેરબજારમાં મોટા ધબકા અટકી શક્યા હતા.

ટોચની ૧૦ કંપનીઓના માર્કેટ કેપમાં ૨.૨૦ લાખ કરોડનો વધારો

નવી દિલ્હી: રજાઓના કારણે ગયા સપ્તાહે ઘટાડો થયો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન, દેશની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી ચારના સંયુક્ત બજાર મૂલ્યમાં ૨.૨૦ લાખ કરોડનો વધારો થયો હતો, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ વધ્યો હતો. સેન્સેક્સ પણ ૪૮૮.૨૯ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા વધ્યો હતો, જોકે બજાર અસ્થિર રહ્યું હતું. ગયા અઠવાડિયે, ભારતની ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી ચારના સંયુક્ત બજાર મૂલ્યમાં ૨.૨૦ લાખ કરોડનો વધારો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ વધ્યો હતો. રજાઓને કારણે સપ્તાહ દુર્લભ થયું હતું. ગયા અઠવાડિયે BSE સેન્સેક્સ ૪૮૮.૨૯ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા વધ્યો હતો.

નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે નોટોનું કુલ મૂલ્ય ૩.૫૬ લાખ કરોડ ૨૦૦૦ની ૯૮.૪૭% નોટો પરત આવી ૫૪૫૧ કરોડની નોટો લોકો પાસે: RBI

નવી દિલ્હી, તા.૩

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ૨,૦૦૦ ની ૯૮.૪૭ ટકા નોટો હવે બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. RBI ના ડેટા અનુસાર, ૧૯ મે, ૨૦૨૩ ના રોજ જ્યારે ૨,૦૦૦ ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ચલણમાં રહેલી આ નોટોનું કુલ મૂલ્ય ૩.૫૬ લાખ કરોડ હતું. હવે, ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં આ ૨૬મ ઘટીને માત્ર ૫,૪૫૧ કરોડ થઈ ગઈ છે. RBI એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ૧૯ મે, ૨૦૨૩ ના રોજ ચલણમાં રહેલી ૨,૦૦૦ ની નોટોમાંથી ૯૮.૪૭ ટકા પરત આવી ગઈ છે.

૨,૦૦૦ ની નોટો બદલવા અને જમા કરાવવાની સુવિધા હજુ પણ RBI ની ૧૯ પ્રાદેશિક કચેરીઓમાં ઉપલબ્ધ છે. આ કચેરીઓ ઓક્ટોબર ૨૦૨૩ થી બેંક ખાતાઓમાં સીધી જમા કરાવવાની પણ ઓફર કરશે. નાગરિકો ૨,૦૦૦ ની નોટો ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ RBI પ્રાદેશિક કચેરીમાં મોકલીને તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે છે. RBI એ પણ પુનરોચ્ચાર કર્યો કે ૨,૦૦૦ ની નોટો કાયદેસર ચલણમાં રહે છે. નવેમ્બર ૨૦૧૬ માં નોંધપાત્ર પછી ૨,૦૦૦ની નોટ બજારમાં રજૂ કરવામાં આવી હતી. તેનો હેતુ તાત્કાલિક રોકડની

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૯૩૩૩થી ૭૬૩૩૩ વચ્ચે અથડાશે

મુંબઈ, તા.૩

તમિલ નાડુ, કેરળ, પશ્ચિમ બંગાળની ચૂંટણીઓના પરિણામો પણ હવે ઝ, મે ના રોજ જાહેર થવાના હોઈ આગામી અઠવાડિયા ભારતીય બજારોમાં વેચિક અને સ્થાનિક પરિભળોએ અડાડાતફડીનું બની રહેવાની પૂરી શક્યતા છે. આગામી સપ્તાહમાં નિકેટી સ્પોટ ૪૩૩૩૩ થી ૩૩૩૩૩ વચ્ચે અને સેન્સેક્સ ૭૯૩૩૩ થી ૭૬૩૩૩ વચ્ચે અથડાશે જોવાઈ શકે છે. યુદ્ધની સ્થિતિ ક્યારેક હળવી બની રહી છે, તો ક્યારે ફરી યુદ્ધ વિરામનો અંત લાવીને ટૂંપ આક્રમક બની ઈરાનને પુ થી પરના નક્કા પરથી ભૂંસી નાખવાની વાત કરીને ઈરાન અને વિશ્વને ચિંતામાં મૂકી રહ્યા છે. ઈરાન પણ સમજૂતી-ડિલ માટે પોતે તૈયાર હોવાનું દર્શાવીને વાટાઘાટ-મંત્રણા માટે પોઝિટીવ હોવાનું કહીને બીજી તરફ અમેરિકાની ન્યુક્લિયર સહિતના કેટલાક મુદ્દા વાત માનવા ઈકાર કરીને સંપૂર્ણ શરણાગતિ સ્વિકારવા તૈયાર નથી. આ અનિશ્ચિતતા વચ્ચે જાણે અમેરિકા થાક્યું હોય એમ હવે ટૂંપ ડિપ્લોમેટિક માર્ગે આ ડિલ પર આગળ વધવાનો અને બીજી જ ક્ષણે ઈરાનને પાયમાલ કરી મુકવાના અંતિમ હુમલા કરવાની ધમકી ઉચ્ચારીને વિશ્વમાં અજાણ્ય કાયમ રાખી રહ્યા છે. આ જો અને તો ની અનિશ્ચિતતા વચ્ચે કુડ ઓઈલના ભાવ ૧૨૮ ડોલર આંબી જવા અને અમેરિકા ડોલર સામે રૂપિયો ૮૫ની સપાટી તોડીને નવા ઐતિહાસિક તળીયે ઉતરી જવાથી ભારત માટે નેગેટીવ પરિભળો રચાયા છે.

આ બેઠકમાં કર્મચારી પક્ષે સરકાર સમક્ષ

જુલાઈના અંતિમ મૂલ્યાંકન પછી તેલ મંત્રાલય વળતરની સમીક્ષા કરશે ઘરેલુ LPG સબસિડીને કારણે OMCsનું નુકસાન વધીને રૂ. ૩૧,૦૦૦ કરોડ થયું કંપનીઓએ પહેલાંથી જ તેલ મંત્રાલયને તેમના નુકસાનનો ડેટા સુપરત કરી દીધો

નવી દિલ્હી, તા.૩

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ બજાર દરથી ઓછા ભાવે સિલિન્ડર સપ્લાય કરવાનું ચાલુ રાખતા ઘરેલુ LPG ના વેચાણ પર વધતા નુકસાનની જાણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ઘરેલુ LPG પર સંચિત નુકસાન આશરે રૂ. ૩૧,૦૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે. કંપનીઓએ પહેલાંથી જ તેલ મંત્રાલયને તેમના નુકસાનનો ડેટા સુપરત કરી દીધો છે, જે દર્શાવે છે કે પ્રતિ સિલિન્ડર આશરે ૨૮૦ રૂપિયાનો નોંધપાત્ર



અંડર-રિકવરીનો અભાવ છે. જો કે, વધતી જતી નાણાકીય કટોકટી છતાં, વળતર માટે હજુ સુધી કોઈ ઔપચારિક દરખાસ્ત રજૂ કરવામાં આવી નથી. સરકારનું ધ્યાન પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર રહે છે. ભારત સરકારે તાજેતરમાં સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ને થયેલા

૮મા પગાર પંચને લઈને કર્મચારી સંગઠનો અને સરકાર વચ્ચેની ઔપચારિક વાટાઘાટો પૂરી થઈ ૮મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં અંદાજે ૨૮૩%નો બમ્પર વધારો થઈ શકે છે!

૭મા પગાર પંચમાં ૨.૫૦નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ છે, જેના કરતાં આ નવી માગ ૧૨૬ બેસિસ પોઈન્ટ વધુ

નવી દિલ્હી, તા.૩

જો યુનિયનોની માંગણીઓ સ્વીકારવામાં આવશે, તો કર્મચારીઓના લઘુત્તમ પગારમાં સીધો ૨૮૩ ટકાનો જંગી વધારો થઈ શકે છે. આનાથી કર્મચારીઓનો બેઝિક પગાર ૧૮,૦૦૦ થી વધીને સીધો ૬૯,૦૦૦ થઈ શકે છે, જેની સીધી અને હકારાત્મક અસર તેમના પેન્શન પર પણ જોવા મળશે.

હાલમાં ૭મા પગાર પંચ મુજબ કર્મચારીઓને દર મહિને લઘુત્તમ મૂળ પગાર ૧૮,૦૦૦ મળે છે. અગાઉ ૬જા પગાર પંચમાં આ આંકડો માત્ર ૭,૦૦૦ હતો. તાજેતરમાં ૨ થી ૩૦ એપ્રિલ દરમિયાન નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના આશરે ૩.૬ બિલિયન (૩૬ લાખ) કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર અને પેન્શન વધારા તેમજ ભથ્થામાં સુધારા માટે જોરદાર માંગ કરવામાં આવી છે.

આ બેઠકમાં કર્મચારી પક્ષે સરકાર સમક્ષ



૩.૮૩ ના ફિટમેન્ટ ફેક્ટરની માંગણી મૂકી છે. અત્યારે ૭મા પગાર પંચમાં ૨.૫૦ નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ છે, જેના કરતા આ નવી માંગ ૧૨૬ બેસિસ પોઈન્ટ વધુ છે. જો સરકાર આ ૩.૮૩ ફિટમેન્ટ ફેક્ટરને લીલી ઝંડી આપે છે, તો પગારમાં સીધો ૨૮૩% નો ઉછાળો આવશે. આનો સીધો અર્થ એ

અને પેન્શન નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, જો તમારો હાલનો બેઝિક પગાર ૧૮,૦૦૦ છે અને નવો પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર ૩.૮૩ લાગુ પડે છે, તો તમારો નવો બેઝિક પગાર (૧૮,૦૦૦ x ૩.૮૩) = ૬૯,૯૪૦ થશે. મતલબ કે ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે હશે, કર્મચારીના પગાર અને પેન્શનમાં એટલો જ મોટો ફાયદો થશે. કર્મચારી સંગઠનોએ લઘુત્તમ બેઝિક પગાર ૬૯,૦૦૦ નક્કી કરવાનો જે પ્રસ્તાવ મૂક્યો છે, તેની પાછળ એક ખાસ ગણતરી છે. ૭મા પગાર પંચ વખતે લઘુત્તમ પગારની ગણતરી ૩ લોકોના પરિવાર (પતિ, પત્ની અને ૨ બાળકો જેને ૨ યુનિટ ગણવામાં આવતા) ના આધારે થતી હતી. પરંતુ હવે મોંઘવારીને જોતાં યુનિયનોનું કહેવું છે કે પરિવારમાં વૃદ્ધ માતા-પિતાને પણ ગણવા જોઈએ, જેથી પરિવારનું કદ વધીને ૫ લોકોનું થઈ જાય. એટલે કે પગાર વધારાની આ નવી માંગ ૫ લોકોના પરિવારના આજના ખર્ચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

રિલાયન્સ ઈન્ડ. મે મહિનાની શરૂઆતમાં જિયોના IPO માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરશે

નવી દિલ્હી, તા.૩

બ્રોકરેજને અપેક્ષા છે કે Jio નાણાકીય વર્ષ ૨૦ માં રૂ. ૧,૪૬,૩૦૦ કરોડની આવક નોંધાવશે, જે નાણાકીય વર્ષ ૨૦ માં વધીને રૂ. ૧,૬૩,૪૦૦ કરોડ થશે.

મુકેશ અંબાણીએ ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત દરમિયાન એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મને એ જાણીને આનંદ થાય છે કે અમે જિયો પ્લેટફોર્મની વિસ્તૃત તરફ સતત આગળ વધી રહ્યા છીએ. આ તેની સફરમાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ બનશે.”

અહેવાલો સૂચવે છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મે મહિનાની શરૂઆતમાં જિયોના IPO માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરી શકે છે, અને નોંધુરા માને છે કે આ ઘટના કોઈપણ ત્રિમાસિક પરિણામ કરતાં શેર માટે વધુ શક્તિશાળી ઉમેરક બની શકે છે.

બ્રોકરેજ રિલાયન્સ પર રૂ. ૧,૬૪૦ ના લક્ષ્ય ભાવ સાથે બાય રેટિંગ જાળવી રાખે છે, જે વર્તમાન રૂ. ૧,૩૨૮ ના ભાવથી આશરે ૨૩.૫% વધુ દર્શાવે છે.

રિપોર્ટ મુજબ, માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં Jio ના ગ્રાહકોની સંખ્યા ૫૨૪ મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે પાછલા ક્વાર્ટરમાં ૫૧૫ મિલિયન હતી. આ ક્વાર્ટરમાં આવક ૩૨,૮૦૦ કરોડ થઈ છે, જે વાર્ષિક ધોરણે ૧૧% વધુ છે, જ્યારે ઈફેક્સ ૧૮,૧૦૦ કરોડ રહ્યું છે, જે એક વર્ષ પહેલાના સમયગાળા કરતા ૧૪% વધુ છે. EBITDA માર્જિન સહેજ સુધર્યાં ૫૪.૩% થયું છે, એમ રિપોર્ટમાં જણાવ્યું છે.

નોમુરાના મતે, સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા પાછલા ક્વાર્ટરની તુલનામાં દર મહિને રૂ. ૨૧૪ પર સ્થિર રહી, પરંતુ એક વર્ષ અગાઉ રૂ. ૨૦૬ થી વધીને. ચર્ન ૧.૭% પર નીચો રહ્યો.

NILA INFRASTRUCTURES LIMITED
(CIN : L45201GJ1990PLC013417)
Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.
Phone: +91 79 4003 6817/18 Fax: +91 79 26873922
E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2026
(₹ in Lakhs, except per share data)

SN	Particulars	Standalone				Consolidated					
		Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended			
		31-03-2026	31-12-2025	31-03-2025	31-03-2026	31-03-2026	31-12-2025	31-03-2025	31-03-2026	31-03-2025	
1	Total Income from Operations	8,103.91	7,503.49	11,341.90	32,270.66	24,688.10	8,103.91	7,503.49	11,341.90	32,270.66	24,688.10
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional Items)	914.35	843.86	863.97	3,757.14	2,989.14	845.20	707.76	788.87	3,386.85	2,873.02
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional Items)	914.35	843.86	863.97	3,757.14	2,989.14	845.20	707.76	788.87	3,386.85	2,873.02
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional Items)	654.10	600.83	607.61	2,699.11	2,153.65	584.95	464.73	536.05	2,328.82	2,049.85
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	659.10	578.84	604.11	2,682.20	2,150.15	590.03	442.74	532.55	2,311.91	2,046.35
6	"Equity Share Capital (Face Value of ₹ 1/- per share)"	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89
7	Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)				16,846.56	14,164.36				14,794.60	12,482.69
8	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)										
	Basic (in ₹)	0.17	0.15	0.15	0.69	0.55	0.15	0.12	0.14	0.59	0.52
	Diluted (in ₹)	0.17	0.15	0.15	0.69	0.55	0.15	0.12	0.14	0.59	0.52

1. The above is an extract of the detailed format of quarter and year ended Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 02, 2026 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarter and year ended Financial Results and Notes thereon are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.nilainfra.com.

2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.

3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Place: Ahmedabad
Date: May 02, 2026

By Order of the Board of Directors
Sd/-
Manoj B Vadodaria
Chairman and Managing Director
DIN: 00092053